

## ભાવનગર મહાનગરપાલિકા - ભાવનગર

જાહેરાત ક્રમાંક :- BMC/૨૦૨૨૨૩/૫ ભાવનગર મહાનગરપાલિકાના "સેનેટરી સબ ઇન્સ્પેક્ટર" સંવર્ગની હાલ ખાલી રહેલ તથા ભવિષ્યે ખાલી પડનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે <http://ojas.gujarat.gov.in> વેબસાઈટ પર તા.૦૧/૦૨/૨૦૨૩, ૧૪:૦૦ કલાક થી તા. ૨૧/૦૨/૨૦૨૩ ૨૩:૫૯ કલાક સુધીમાં ઓન લાઈન ઉમેદવારી કન્ફર્મ કરવા જણાવવામાં આવે છે

ખાસ નોંધ:-ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવેલ છે તે તમામ સંવર્ગોની લેખિત પરીક્ષા એક જ તારીખ અને સમયે લેવાનાર છે જે ધ્યાને લઈ આ સંવર્ગમાં અરજી કન્ફર્મ કરવા તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે

જગ્યાનું નામ :- સેનેટરી સબ ઇન્સ્પેક્ટર

સીધી ભરતીથી જગ્યાઓ ભરવાનું માહિતી દર્શાવતું પત્રક

ક્રમ	જગ્યાનું નામ	ભરવા પાત્ર કુલ જગ્યાઓ
૧	સેનેટરી સબ ઇન્સ્પેક્ટર	૧૦

૧. શૈક્ષણિક લાયકાત :-

(૫) સેનેટરી સબ ઇન્સ્પેક્ટર

શૈક્ષણિક લાયકાત -

૧. સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડીપ્લોમાં કોર્સ
૨. ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્વાસીફિકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ
૩. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ

૨. પગાર ધોરણ :-

- (૧) પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ . ૩૧,૩૪૦/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે . ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે -મેટ્રિક્સ લેવલ-૨ સ્કેલ રૂા-૨૯,૨૦૦-૯૨,૩૦૦ નિયમિત નિમાણક મેળવવાને પાત્ર થશે.

૩. ઉંમર :-

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ ઉંમર ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ

૪. વયમર્યાદા:-

- (૧) ૧૮ વર્ષથી ઓછી ઉંમરનો અને ૩૩ વર્ષથી વધુ ઉંમરનો ન હોવો જોઈએ ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહિ. પરંતુ અધિકતમ વયમર્યાદા ૪૫ વર્ષની રહેશે.

- (૨) મૂળ ગુજરાતના હોય તેવા અનામત વર્ગના ઉમેદવારો (આર્થિક રીતે નબળા વર્ગ સહિત) તમામ મહિલા વિકલાંગ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં નિયમોનુસાર નીચે મુજબની છુટછાટ મળવા પાત્ર રહેશે. (ક્રમ નં ૫ ના કોષ્ટકમાં દર્શાવેલ અનામત જગ્યાની વિગતો અનુસાર જે જગ્યા ભરવાપાત્ર છે તે જ અનામત વર્ગના ઉમેદવારોને નિયમાનુસારની છુટછાટ મળવાપાત્ર થશે. જેની નોંધ લેશો.)

૧. સામાન્ય મહિલા ઉમેદવારોને ૫ વર્ષ
૨. અનામત વર્ગના પુરૂષ ઉમેદવારોને ૫ વર્ષ
૩. અનામત વર્ગના મહિલા ઉમેદવારોને ૧૦ વર્ષ
૪. સામાન્ય વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારોને ૦૫ વર્ષ
૫. સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને ૧૦ વર્ષ
૬. અનામત વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારોને ૧૦ વર્ષ
૭. અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને ૧૫ વર્ષ

૮. માજી સૈનિક ઉમેદવાર માટે:-

- (I) માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ છુટછાટ મળવાપાત્ર છે.
- (II) ઉમેદવાર પોતે જ માજી સૈનિક હોવા જોઈએ , માજી સૈનિક ઉમેદવારોએ અરજીપત્રકમાં તથા પરિશિષ્ટમાં માજી સૈનિક તરીકે ફરજ બજાવ્યાના સમયગાળાની વિગતો આપવાની રહેશે . માજી સૈનિક ઉમેદવારે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃવસવાટ કચેરી દ્વારા નિયત નમુના મુજબનું કાયદા દ્વારા અધિકૃત કરેલ અધિકારીની સહિવાળ ૬ સહિવાળું, સશસ્ત્રદળોમાં ઉમેદવારના નોકરીના

સમયગાળા દર્શાવતું પ્રમાણપત્ર ભાવનગર મહાનગરપાલિકા સમક્ષ માંગણી થયેથી રજુ કરવાનું રહેશે . જો ઉમેદવારે તેની ઓનલાઈન અરજીમાં માજી સૈનિક કેટેગરીમાં ક્લીક કરેલ હોય અને ભવિષ્યમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા માંગણી કરાયત્યારે જો ઉમેદવાર માજી સૈનિક તરીકેના અધિકૃત આધાર પુરાવા રજુ કરવામાં નિષ્ફળ જાય તેવા સંજોગોમાં ઉમેદવારનો માજી સૈનિક તરીકે નોકરી મેળવવા અંગેનો હક્ક દાવો ધ્યાને લેવામાં આવશે નહીં અને માજી સૈનિક માટે ઠરાવેલ મેરીટ અન્વયે પસંદગી થયેલ હશે તો પસંદગી / નિમણૂક રદ કરવામાં આવશે. જેની ઉમેદવારે નોંધ લેવી. માજી સૈનિક માટે નિયમાનુસાર ૧૦% જગ્યા અનામત છે. માજી સૈનિક કેટેગરીમાં પસંદ થયેલ ઉમેદવારોને તેઓની સંબંધિત જે તે કેટેગરી (જનરલ, એસ.સી., એસ.ટી., એસ.ઈ.બી.સી., આર્થિક રીતે નબળા વર્ગ) સામે સરભર કરવામાં આવશે માજી સૈનિકની અનામત જગ્યાઓ માટે લાયક માજી સૈનિક ઉમેદવાર નહીં મળે તો તે જગ્યા જે તે કેટેગરીનાં અન્ય લાયક ઉમેદવારથી ભરવામાં આવશે.

- (૩) તમામ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયત, તારીખે કોઈપણ સંજોગોમાં ૪૫ વર્ષ કરતાં વધવી જોઈએ નહીં.
- (૪) તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અરજી છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે.

**નોંધ :-**

- (૧) અનામત કક્ષાના ઉમેદવારો બિનઅનામત જગ્યા માટે અરજી કરી શકશે પરંતુ તેમને પસંદગી માટેના ધોરણો બિનઅનામત કક્ષાના લાગુ પડશે.
- (૨) ઉંમર અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે.

**૫. અનામત જગ્યાઓની વિગત**

કુલ જગ્યા	અનુસુચિત જાતિ		અનુસુચિત જનજાતિ		સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ		આર્થિક રીતે પછાત વર્ગ		બિન અનામત	
	સામાન્ય	મહિલા	સામાન્ય	મહિલા	સામાન્ય	મહિલા	સામાન્ય	મહિલા	સામાન્ય	મહિલા
૧૦	૦	૦	૨	૦	૧	૧	૧	૦	૩	૨

- સરકારશ્રીની સ્થાયી પ્રવર્તમાન સુચનાઓ મુજબ આ સંવર્ગની કુલ ખાલી જગ્યાઓ પૈકી અનુસુચિતજાતિ(S.C.), અનુસુચિત જનજાતિ (S.T.) , સા.શૈ.પ.વર્ગ(S.E.B.C.) , આર્થિક રીતે નબળા વર્ગ(EBC) માટે અનામત રાખવામાં આવશે.
- તદઉપરાંત (અ) માજી સૈનિક માટે જે-તે કેટેગરીમાં ૧૦ ટકા જગ્યાઓ (બ) શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે ૩ ટકા જગ્યાઓ અને (ક) મહિલાઓ માટે ૩૩ ટકા અનામત રાખવામાં આવશે.

**(૧) મહિલા ઉમેદવારો માટે:-**

સામાન્ય વહીવટ વિભાગના તા.૧૧/૧૧/૨૦૧૪ના ઠરાવ ક્રમાંક -સીઆરઆર / ૧૦૮૬/૨૨૧૩/ગ.૨(ભાગ-૧) તથા તા.૦૧/૦૮/૨૦૧૮ના ઠરાવ ક્રમાંક:સીઆરઆર/૧૦૮૬/૨૨૧૩/ગ-૨ ની જોગવાઈઓ ધ્યાને લઈને, મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવેલ છે. મહિલાઓની અનામત જગ્યાઓ માટે લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો, તે જગ્યા સંબંધિત કેટેગરી (જનરલ, એસ.સી., એસ.ટી., એસ.ઈ.બી.સી.,ઈ.બી.સી) ના પુરૂષ ઉમેદવારથી ભરવામાં આવશે.

**(૨) વિધવા ઉમેદવારો માટે:-**

- (૧) ઉમેદવાર વિધવા હોય તો અરજીપત્રમાં તે કોલમ સામે હા અવશ્ય લખવું અન્યથા લાગુ પડતું નથી એમ દર્શાવવું.
- (૨) વિધવા ઉમેદવારે જો પુનઃ લગ્ન કરેલ હોય તો અરજીપત્રમાં તે કોલમ સામે હા અવશ્ય લખવું અન્યથા લાગુ પડતું નથી એમ દર્શાવવું.
- (૩) વિધવા ઉમેદવારે પુનઃ લગ્ન કરેલ ન હોય અને વિધવા ઉમેદવાર તરીકે લાભ મેળવવા ઈચ્છતા હોય તો, ઉમેદવારે નિમણૂક સતાધિકારી/ભાવનગર મહાનગરપાલિકા સમક્ષ પ્રમાણપત્ર ચકાસણી સમયે પુનઃ લગ્ન કરેલ નથી તેવું એફિરિવિટ અચૂક રજુ કરવાનું રહેશે.
- (૪) વિધવા ઉમેદવારને સરકારશ્રીની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લેખિત પરીક્ષામાં તેઓએ મેળવેલ કુલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરવામાં આવશે.
- (૫) કોઈપણ મહિલા ઉમેદવાર જાહેરાત માટે અરજી કરે તે સમયે વિધવા ન હોય , પરંતુ અરજી કર્યા બાદ અથવા જાહેરાત પ્રસિધ્ધ થયાની છેલ્લી તારીખ વીતી ગયા બાદ અથવા ભરતી પ્રક્રિયાના કોઈપણ તબક્કે વિધવા બને અને તે અંગે જરૂરી દસ્તાવેજ પુરાવાઓ રજુ કરે તો તેની રજુઆત મળ્યા તારીખ પછીના ભરતી પ્રક્રિયાના જે પણ તબક્કા બાકી હોય તે તબક્કાથી જ તેવા મહિલા ઉમેદવારોને વિધવા મહિલા ઉમેદવાર તરીકેના લાભ આપવામાં આવશે.

### (૩) માજી સૈનિક ઉમેદવારો માટે:-

- ઉમેદવાર પોતે જ માજી સૈનિક હોવા જોઈએ
- માજી સૈનિક માટે નિયમાનુસાર ૧૦% જગ્યા અનામત છે. માજી સૈનિક કેટેગરીમાં પસંદ થયેલ ઉમેદવારોને તેઓની સંબંધિત જે તે કેટેગરી ( જનરલ, એસ.સી, એસ.ટી, એસ.ઈ.બી.સી.ઈ.ડબલ્યુ.એસ.) સામે સરભર કરવામાં આવશે. માજી સૈનિકની અનામત જગ્યાઓ માટે લાયક માજી સૈનિક ઉમેદવાર નહીં મળે તો તે જગ્યા જે તે કેટેગરીનાં અન્ય લાયક ઉમેદવારથી ભરવામાં આવશે.

### (૪) શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે:-

- શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોની અનામત રાખેલ ૩ ટકા જગ્યાઓ સામે પસંદગી પામેલ ઉમેદવારને જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે. શારીરિક અશક્ત વ્યક્તિઓ માટે જગ્યાઓ અનામત રાખવા બાબતે નીચે મુજબની જોગવાઈ થયેલ છે.

ક્રમ	વિકલાંગતાની કેટેગરી	અનામત જગ્યાની ટકાવારી	વિકલાંગતાનો પ્રકાર
૧	શ્રવણની ખામી	૧.૫	HH- Hearing handicapped
૨	હલનચલનની અશક્તતા અથવા મગજનો લકવા	૧.૫	OA (OA- one arm affected ( R or L ) a. Impaired reach b. Weakness of grip c. Ataxic OAL =one arm and one leg affected

- શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોએ અરજીપત્રકમાં ચોકકસ માહિતી આપવાની રહેશે.
- ૪૦ ટકા કે તેથી વધુ અને ૭૫ ટકા કે તેથી ઓછી શારીરિક અશક્તતા ધરાવતા હોય તેવા ઉમેદવારોને જ શારીરિક અશક્તતાનો લાભ મળવાપાત્ર રહેશે શારીરિક અશક્તતાનો લાભ મેળવવા ઈચ્છતા ઉમેદવારે (૧) શ્રવણની ખામી (૨) હલનચલન અશક્તતા અથવા મગજનો લકવો તે પૈકીની કઈ શારીરિક અશક્તતા છે તે સ્પષ્ટ દર્શાવવું.
- શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવાર માટે સામાન્ય વહીવટ વિભાગનાતા .૦૧-૧૨-૨૦૦૮ના પરીપત્ર ક્રમાંક :- પરચ/૧૦૨૦૦૮/૪૬૮૫૪૦/ગ-૨ થી નિયત થયેલ નમુનામાં સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ/સિવિલ સર્જન /મેડીકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર જ માન્ય ગણવામાં આવશે. તેમજ આ અસલ પ્રમાણપત્ર નિમણૂક અધિકારી / ભાવનગર મહાનગરપાલિકા સમક્ષ રજુ કરવામાં નહિ આવે, તેવા કિસ્સામાં જે તે ઉમેદવારને શારીરિક અશક્ત ઉમેદવાર તરીકેનો લાભ મળવા પાત્ર થશે નહિ અને પસંદગી / નિમણૂક રદ કરવામાં આવશે. શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજીમાં અશક્તતા પ્રકાર ,પ્રમાણપત્ર નંબર અને તારીખ યોગ્ય કોલમમાં અચુક દર્શાવવાના રહેશે.
- શારીરિક અશક્તતાની જગ્યા જે તે કેટેગરીની જગ્યા સામે સરભર કરવામાં આવશે.જો શારીરિક અશક્તતાના કિસ્સામાં જે તે કેટેગરી માટે નિયમાનુસાર અનામત રાખવામાં આવેલ જગ્યાઓ સામે લાયક ઉમેદવાર ઉપલબ્ધ નહિ થાય તેવા કિસ્સામાં તે જગ્યાઓ જે તે કેટેગરીના અન્ય ઉમેદવારોથી ભરવામાં આવશે.

### (૫) સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે:-

- સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૦૬-૦૨-૧૯૯૬ ના ઠરાવથી નિયત થયેલ પરીશિષ્ટ - (ક) મુજબનું અથવા ઉક્ત વિભાગના તા.૨૭-૦૪-૨૦૧૦ ના ઠરાવથી નિયત કરાયેલ ગુજરાતી નમૂના પરીશિષ્ટ-૪ મુજબનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- તારીખ ૦૧-૦૪-૨૦૨૧ના રોજ કે ત્યારબાદ ઈસ્યું થયેલ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્રની મહત્તમ અવધિ ઈસ્યું થયા વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષની રહેશે. પરંતુ આવું પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઈસ્યું થયેલ હોવું જોઈએ.

### (૬) આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે:-

- આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા .૨૫/૦૧/૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક :ઈ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૮/૪૫૮૦૩/અ મુજબ નિયત થયેલ ગુજરાતી નમૂના પરિશિષ્ટ-ગ મુજબનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- આવું પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઈસ્યું થયેલ હોવું જોઈએ.

**(૭) કોમ્પ્યુટરની જાણકારી:-**

ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા -૧૩/૮/૨૦૦૮ ના સરકારી ઠરાવ નં.સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩ ૨૦-ગ-પ , થી નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ માન્ય તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર / માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા /ડીગ્રી કે સર્ટીફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડીગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ -૧૦ અથવા ધોરણ-૧૨ ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈશે. આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે, પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂંક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝીક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂંક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે . અન્યથા નિમણૂંક મેળવવાને પાત્ર થશે નહિ .તેમજ નિમણૂંક સત્તાધિકારી /ભાવનગર મહાનગરપાલિકા આવા કિસ્સામાં ઉમેદવારોની પસંદગી રદ કરશે.

## જાહેરાતની સામાન્ય જોગવાઈ

### ૧. નાગરિકત્વ:-

- ઉમેદવાર,
- (ક) ભારતનો નાગરિક હોય અથવા
- (ખ) નેપાળનો પ્રજાજન હોય અથવા
- (ગ) ભુતાનનો પ્રજાજન હોય અથવા
- (ઘ) મૂળ ભારતની વ્યક્તિ હોય,

અને ભારતમાં કાયમી વસવાટ કરવાના ઈરાદાથી પાકિસ્તાન,મ્યાનમાર,શ્રીલંકા, કેન્યા,યુગાન્ડા જેવા પૂર્વ આફ્રિકાના દેશો, ટાન્ઝાનિયાનો સંયુક્ત પ્રજા સત્તાક,(અગાઉ ટાન્ગાનિકા અને ઝાંઝીબાર,) ઝામ્બીયા, મલાવી,ઝૈર, ઈથોપીયાઅને વિયેટનામમાંથી સ્થળાંતર કરીને આવી હોય.પરંતુ (ખ),(ગ),(ઘ) વર્ગ હેઠળ આવતાઉમેદવારના કિસ્સામાં સરકારે પાત્રતા પ્રમાણપત્ર આપેલ હોવું જોઈએ.

### નોંધ :-

જે ઉમેદવારના કિસ્સામાં પાત્રતા પ્રમાણપત્ર જરૂરી હોય તેવા ઉમેદવારનું અરજીપત્રક ભાવનગર મહાનગરપાલિકા વિચારણામાં લેશેઅને જો નિમણૂંક માટે તેમના નામની ભલામણ કરવામાં આવશે તો નિયમાનુસાર તેમનાં કિસ્સામાં પાત્રતા પ્રમાણપત્ર ઉમેદવાર દ્વારા રજૂ થવાની શરતે કામચલાઉ નિમણૂંક આપશે.

### ૨. ભરેલા અરજીપત્રક:-

- (૧) જો એક કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને પ્રત્યેક અરજી સાથે બીન અનામત વર્ગ માટે નિયત રૂ.૫૦૦/- તથા અનામત વર્ગના ઉમેદવારે રૂ.૨૫૦/- ફી ભરવાની રહેશે.
- (૨) અરજી ફી વગરની અગ્રિમ નકલ વિચારણામાં લેવામાં આવશે નહીં.
- (૩) ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી /સંસ્થાની માર્કશીટ (બધા જ વર્ષો /સેમેસ્ટર)ના અસલ પ્રમાણપત્રો તથા તેની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે .તેમજ અનુભવ અંગેના પ્રમાણપત્રો પણ રજૂ કરવાના રહેશે.કોલેજના આચાર્ય દ્વારા અપાયેલ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં.
- (૪) જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત ના હોય તો પણ જે તે કેટેગરીમાં મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે .
- (૫) કોઈપણ સંજોગોમાં અરજી ફી પરત મળવા પાત્ર નથી.

### ૩. શૈક્ષણિક લાયકાત:-

- (૧) ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ધરાવતા હોવા જોઈએ.
- (૨) ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ.
- (૩) ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી /સંસ્થાની અસલ માર્કશીટ (બધા જ વર્ષો /સેમેસ્ટર)તથા તેની સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે . કોલેજના આચાર્ય દ્વારા અપાયેલ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં.
- (૪) શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણે માન્ય રાખવી તેવો ઉમેદવારનો હક્ક દાવો સ્વીકારવામાં આવશે નહીં.
- (૫) જાહેરાતમાં દર્શાવેલ લાયકાતની સમકક્ષ લાયકાત ઉમેદવાર ધરાવે છે , તેવો તેમનો હક્કદાવોહોય તો આવા ઉમેદવારે સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો/અધિકૃતતાની વિગતો આપવાની રહેશે.

### ૪. ના વાંધા પ્રમાણપત્ર:-

- (૧) ગુજરાત સરકારના સરકારી / અર્ધસરકારી /સરકાર હસ્તકના કોર્પોરેશન / કંપનીઓમાં સેવા બજાવતા અધિકારીઓ / કર્મચારીઓ ભાવનગર મહાનગરપાલિકાની જાહેરાતના સંદર્ભમાં બારોબાર ઓનલાઈન અરજી કરી શકશે અને તેની જાણ ઉમેદવારે પોતાના વિભાગ/ ખાતા /કચેરીને અરજી કર્યાની તારીખથી દિ-૭ માં અચુક કરવાની રહેશે. જો ઉમેદવારના નિયોક્તા તરફથી અરજી મોકલવાની છેલ્લી તારીખ બાદ 30 દિવસમાં અરજી કરવાની પરવાનગી નહીં આપવાની જાણ કરવામાં આવશે તો તેઓની અરજી નામંજૂર કરી ઉમેદવારી રદ થવા પાત્ર રહેશે.
- (૨) ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

### ૫. ગેરલાયક ઉમેદવાર :-

- (૧) ભાવનગર મહાનગરપાલિકા કે અન્ય મહાનગરપાલિકા અથવા અન્ય સરકારી / અર્ધ સરકારી /સરકાર હસ્તકની સંસ્થાઓ દ્વારા ઉમેદવાર ક્યારેય પણ ગેરલાયક ઠરાવેલા હોય તો તેની વિગત અરજી પત્રકમાં આપવાની રહેશે. જો ઉમેદવારનો ગેરલાયકીનો સમય ચાલુ હશે તો આવા ઉમેદવારની અરજી રદ થવાને પાત્ર બનશે.
- (૨) ફરજિયાત નિવૃત્તિ,રુખસદ, બરતરફ :-

અગાઉ ઉમેદવારને સરકારી સેવા / સરકાર હસ્તક ની કંપની કે બોર્ડ કોર્પોરેશન માંથી ક્યારેય પણ ફરજિયાત નિવૃત્તિ, રુખસદ કે બરતરફ કરવામાં આવેલ હોય તો અરજીપત્રકમાં તેની વિગત આપવાની રહેશે. નિમણૂક મળ્યા બાદ આ બાબત ધ્યાન ઉપર આવશે તો નિમણૂક રદ કરવામાં આવશે.

#### ૬. અગત્યની જોગવાઈ:-

- (૧) ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિને જરૂર જણાયે ખરેખર ભરવાપાત્ર સંખ્યા અને આવેલ કુલ અરજીઓની સંખ્યા ધ્યાને રાખી જે યોગ્ય જણાશે તેવી કટ ઓફ ટકાવારી નક્કી કરી મેરીટલિસ્ટ તૈયાર કરી, ફક્ત શોર્ટલિસ્ટેડ ઉમેદવારો ને લેખિત પરીક્ષા / મૌખિક કસોટી માટે કોલલેટર ઈસ્યુ કરશે તેમજ જરૂર જણાયે આ શોર્ટલિસ્ટેડ ઉમેદવારો ને તેઓના અસલ પ્રમાણપત્રો તેમજ અન્ય આનુષંગિક આધારોની ચકાસણી કરવા માટે જાણ કરવામાં આવશે. ફાઈનલ મેરીટ લિસ્ટ મૂળભૂત લેખિત પરીક્ષા / મૌખિક કસોટી માં મળેલ માર્ક્સની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે.
- (૨) સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની જગ્યા માટે મૂળભૂત લાયકાત સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઈન્સ્પેક્ટરનો ડીપ્લોમા કોર્સની ટકાવારીને આધારે લેખિત પરીક્ષા માટે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ૧૦(દસ) જગ્યા ભરવાપાત્ર હોય તેની સામે પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે તેટલા ઉમેદવારોને લેખિત કસોટી / મૌખિક કસોટી માટે કોલ લેટર ઈસ્યુ કરવામાં આવશે. મેરીટ લિસ્ટ તૈયાર કરતા સમયે અંતિમ ક્રમે આવતા સમાન ગુણવાળા તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા / મૌખિક કસોટી માટે કોલ લેટર ઈસ્યુ કરવામાં આવશે.
- (૩) સરકારી / અર્ધસરકારી સંસ્થામાં ફરજ બજાવતાં ઉમેદવારો જો ઉક્ત જગ્યાએ પસંદગી પામશે તો તેઓએ મૂળ જગ્યાએથી રાજીનામું આપ્યા બાદ જ નિમણૂકની જગ્યાએ હાજર થવાનું રહેશે તેમજ તેઓની અગાઉની બજાવેલ ફરજનો સમયગાળો નિયમબદ્ધ કરી શકાશે નહીં/ ગણતરીમાં લેવામાં આવશે નહીં.
- (૪) ઓનલાઈન અરજી કરતા ઉમેદવારોએ અરજી ફોર્મમાં ભરવામાં આવેલ માહિતી / વિગતોમાં કોઈ ભુલ કે ક્ષતિ કરવામાં આવેલ હશે તો તે અરજી રદ ગણવામાં આવશે અને આ બાબતે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
- (૫) યુનિવર્સિટી અથવા કોઈ સંસ્થા માર્ક્સ ટકાવારીને બદલે CPI / CGPA / SGPA / OGPA / ગ્રેડ દર્શાવતી હોય તો તેવા કિસ્સામાં ઉમેદવારે તે માર્ક્સને યુનિવર્સિટી અથવા સંસ્થાના માન્ય સુત્રમાં ટકાવારીમાં ગણતરી કરી અરજી ફોર્મમાં ટકાવારી જ દર્શાવવાની રહેશે જો કોઈ ઉમેદવાર અરજી ફોર્મમાં CPI / CGPA / SGPA / OGPA / ગ્રેડ દર્શાવશે તો તેઓની અરજી ધ્યાને લેવામાં આવશે નહિ , જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી
- (૬) દરેક જાહેરાત માટે ઉમેદવારે એક જ અરજી કરવી. આમ છતાં, સર્જોગોવશાત, જો કોઈ ઉમેદવારે એકથી વધુ અરજી કરેલ હશે, તો છેલ્લી કન્ફર્મ થયેલ અરજી, તેની સાથે નિયત ફી ભરેલ હશે, તો તે માન્ય ગણાશે અને અગાઉની અરજી રદ ગણવામાં આવશે. અગાઉની અરજી સાથે ભરેલ છેલ્લી કન્ફર્મ થયેલ અરજી સામે ગણવામાં આવશે નહીં. જો ઉમેદવારે એકથી વધુ અરજી સાથે ફી ભરેલ હશે તો તે રીફંડ કરવામાં આવશે નહીં.

(૭) પસંદગી પામનાર ઉમેદવારે મહાનગરપાલિકા દ્વારા નિયત કરાયેલ બોન્ડ / સંમતીપત્રક આપવાના રહેશે

#### ૭. રમતવીરો માટે -

એથલેટીક્સ(ટ્રેક અને ફિલ્ડ રમતો સહિત), બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફુટબોલ, હોકી, સ્વિમિંગ ટેબલ ટેનિસ, વોલિબોલ, ટેનિસ, વેઈટ લિફ્ટિંગ, રેસિંગ, બોક્સિંગ, સાઈકલિંગ, જીમનેસ્ટિક્સ, જુડો, રાઈફલ શૂટિંગ, કબડ્ડી, ખો-ખો, તીરંદાજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકા સ્પર્ધા, શતરંજ, હેન્ડબોલની રમતો-ખેલક્રમમાં (૧) રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય અથવા (૨) આંતર યુનિવર્સિટી અથવા (૩) અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે તેમને માત્ર પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના ૫ (પાંચ)% ગુણ ઉમેરી આપવામાં આવશે. આ માટે ઉમેદવારે સરકારશ્રીના તા. ૨૫-૨-૧૯૮૦ના ઠરાવ ક્રમાંક:સી.આર.આર/૧૦૭૭/૨૬૬૦/ગ.૨ તથા તા.૧-૮-૧૯૮૦ના ઠરાવક્રમાંક:સી.આર.આર/1188/3644/ ગ.2 માં નિયત કર્યા મુજબના સત્તાધિકારી પાસેથી નિયત નમુનામાં મેળવેલ જરૂરી પ્રમાણપત્ર સમિતિ માંગે ત્યારે રજુ કરવાનું રહેશે. આવું પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવાર જ રમતનાં ગુણ માટે હકદાર થશે.

#### ૮. લેખિત પરીક્ષા/મૌખિક કસોટી :-

- (૧) લેખિત પરીક્ષા/મૌખિક કસોટી ભાવનગર શહેર ખાતે જ લેવામાં આવશે. ઉમેદવારે પોતાના ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.
- (૨) લેખિત પરીક્ષાનું માધ્યમ જગ્યાની મુજબ શૈક્ષણિક લાયકાતના કોર્સને અનુરૂપ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે અન્યથા ગુજરાતી રહેશે(અંગ્રેજી વિષયના પ્રશ્નોનું માધ્યમ અંગ્રેજી રહેશે).
- (૩) લેખિત પરીક્ષામાં ઉત્તિર્ણ થવા માટે કુલ ગુણના ઓછામાં ઓછા 45% ગુણ હોવા ફરજિયાત રહેશે. 45% થી ઓછા ગુણ ધરાવતા ઉમેદવારો આગળની પ્રક્રિયા માટે ગેરલાયક ઠરશે
- (૪) મહાનગરપાલિકાની કોઈ પણ સંવર્ગમાં સીધી ભરતીથી ભરવાપાત્ર જગ્યાઓ પર નિમણૂક કાર્યવાહી કરતા પુર્વે તમામ પરીક્ષાર્થીઓના

ગુણ ધરાવતા જનરલ મેરીટ લિસ્ટમાંથી, કુલ ગુણના ૫૦%થી વધુ ગુણ ધરાવતા ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ તૈયાર કરવાનું રહેશે. આ મેરીટ લિસ્ટ પ્રસિધ્ધ થયેથી બે વર્ષ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન જે-તે સંવર્ગમાં કોઈ પણ કારણોસર ખાલી પડેલ જગા કે જે સીધી ભરતીથી ભરવાપાત્ર થતી હોઈ તો તેવી જગાઓ પર આ મેરીટ લિસ્ટમાંથી જે-તે કેટેગરીવાઈઝ ઉમેદવારોને નિમણૂક આપી શકાયે.

- (૫) ઉપરોક્ત દર્શાવેલ જગ્યાની સંખ્યામાં ફેરફાર કરવાનો કમિશ્નર, મહાનગરપાલિકા, ભાવનગરને અબાધિત અધિકાર રહેશે.
- (૬) જાહેરાતની જોગવાઈઓના અર્થઘટન અને આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશ્નર, ભાવનગર મહાનગરપાલિકાનો નિર્ણય આખરી અને તમામને બંધનકર્તા રહેશે.

કમિશ્નર  
ભાવનગર મહાનગરપાલિકા,  
ભાવનગર

## online અરજી કરવાની તથા અરજી ફી ભરવાની રીત

**આ જાહેરાતના સંદર્ભમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઓન લાઈન અરજી જ સ્વીકારવામાં આવશે**

ઉમેદવાર તા.૦૧/૦૨/૨૦૨૩, ૧૪:૦૦ કલાક થી તા ૨૧/૦૨/૨૦૨૩ કલાક ૨૩:૫૯:૦૦ સુધીમાં <http://ojas.gujarat.gov.in> પર અરજી પત્રક ભરી શકશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના Steps (૧) થી (૧૬) અનુસરવાના રહેશે. Confirmation Number મળ્યા પછી જ અરજી માન્ય ગણાશે.

**નોંધ- આ વિગતો માત્ર ઉમેદવારના માર્ગદર્શન માટે છે**

- (૧) સૌ પ્રથમ <http://ojas.gujarat.gov.in> પર જવું.
- (૨) Apply Online Click કરવું.  
આ પ્રમાણે click કરવાથી (૧) More Details તથા (૨) Apply Now બટન દેખાશે. સૌપ્રથમ More Details પર click કરીને જાહેરાતની બધી જ વિગતોનો અભ્યાસ ઉમેદવારોએ કરવો. અને ત્યારબાદ Apply Now બટન click કરવું.
- (૩) સેનેટરી સબ ઈ-સ્પેક્ટર ઉપર click કરવાથી જગ્યાની વિગતો મળશે.
- (૪) તેની નીચે Apply Now પર click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌપ્રથમ “personal Details” ઉમેદવારે ભરવી. (અહીં લાલ ફુદરડી (\*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.) “personal Details” માં જ્યાં Mobile Number અને email ID માંગ્યા છે, તેની વિગત લખવી જેથી જરૂર જણાયે ભાવનગર મહાનગરપાલિકા ઉમેદવારનો સંપર્ક કરી શકે.
- (૫) Personal Details ભરાયા બાદ Educational Details ભરવા માટે Educational Details પર Click કરવું અને પોતાની શૈક્ષણિક વિગતો ભરવી.
- (૬) Additional Qualification પર “click” કરી Additional Qualification ભરવી.
- (૭) Experience Details પર “click” કરવું અને Experience Details ભરવી. વધુ Experience ઉમેરવા માગતા હોવ તો Add. More Exp. પર “click” કરી Details ભરવી.
- (૮) Additional Information પર “click” કરી ત્યાં માહિતી ભરવી. જો વધારાનો અનુભવ ojas Module માં સમાવિષ્ટ ન થતો હોય, તો સાદા કાગળ પર ojasમાં જણાવ્યા મુજબના અનુભવના કોઠા પ્રમાણે આપે વધારાના અનુભવની વિગત ઉમેરીને મોકલવી.
- (૯) તેની નીચે “self-Declaration” માં Yes/ No પર click કરવું.
- (૧૦) હવે save પર “click” કરવાથી તમારો Data Save થશે. અહિં ઉમેદવારનો Application Number generate થશે.
- (૧૧) જો આપની અરજીપત્રકમાં કોઈ સુધારા -વધારા કરવાના હોય તો Edit Applicationમાં જઈને કરી શકાશે, આ સુવિધા અરજી Confirm કરતાં પહેલા ઉપલબ્ધ છે. એક વખત અરજી Confirm થઈ ગયા પછી/બાદ આ સુવિધા ઉપલબ્ધ રહેશે નહિં.
- (૧૨) હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો અહિં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ ok પર click કરો. અહિં Photo અને Signature Upload કરવાના છે. (ફોટાનું માપ 5 સે.મી. ઉંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ અને Signature નું માપ 2.5 સે.મી. ઉંચાઈ અને 7.5 સે.મી પહોળાઈ રાખવી) ( Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature .jpg Formatમાં (15KB) સાર્થક થી વધારે નહિં તે રીતે Computer માં હોવા જોઈએ) “Browse” Button પર click કરો હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં .jpg Format માં તમારો Photo Store થયેલ છે તે ફાઈલને ત્યાંથી Select કરો અને “open” Button પર click કરો હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે બાજુ રીતે Signature પણ upload કરવાની રહેશે.
- (૧૩) હવે પેજના ઉપરના ભાગમાં “Confirm Application” પર Click કરો અને “Application Number” તથા (૧) Birth Date Type કર્યા બાદ ok પર clicks કરવાથી (૨) બટન ૧. Application preview ૨. Confirm Application દેખાશે. ઉમેદવારે “Application preview” પર Click કરી પોતાની અરજી જોઈ લેવી. અરજીમાં સુધારો કરવાનો જણાય, તો Edit Application ઉપર click કરીને સુધારો કરી લેવો. અરજી confirm કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ, અરજી confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ સુધારો થઈ શકશે નહીં. જો અરજી સુધારવાની જરૂર ના જણાય તો જ confirm application પર click કરવું. Confirm application પર click કરવાથી ઉમેદવારની અરજીનો ભાવનગર મહાનગરપાલિકામાં online સ્વીકાર થઈ જશે. અહીં confirmation number generate થશે જે હવે પછીની બધીજ કાર્યવાહી માટે જરૂરી હોય ઉમેદવારે સાચવવાનો રહેશે. Confirmation number સિવાય કોઈપણ અન્ય પત્ર વ્યવહાર કરી શકાશે નહીં. Confirm થયેલ અરજીપત્રકની પ્રિન્ટ અચુક કાઢી રાખવી.
- (૧૪) ઉમેદવારે ભરવાની થતી ફી સંદર્ભ “Print Challan” ઉપર ક્લિક કરીને પ્રિન્ટેડ ચલણની નકલ લઈને નજીકની કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં ઉમેદવારોએ ભરવાની અરજી ફી નીચેના વિકલ્પથી ભરી શકે છે.

**પોસ્ટ ઓફિસમાં :-** બિન અનામત વર્ગના ઉમેદવારોએ રૂ.૫૦૦/- અને અનામત વર્ગના ઉમેદવારોએ રૂ. ૨૫૦/-ભાવનગર મહાનગરપાલિકાની ફી+ પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે. અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે. ભાવનગર મહાનગરપાલિકાની ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ તા.૨૩/૦૨/૨૦૨૩ સુધીમાં ભરવાની રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે. આ ચલણ તથા Confirm થયેલ અરજીપત્રક ઉમેદવારે પોતાની પાસે સાચવીને રાખવાના રહેશે અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મંગાવવામાં આવે, ત્યારે જ અરજીપત્રક બિડાણો સહિત તથા ફી

ભરેલા ચલણની નકલ સાથે આર .પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલવાના રહેશે અથવા ભાવનગર મહાનગરપાલિકાની કચેરીમાં રૂબરૂમાં આપી જવાના રહેશે.

- (૧૫) ઉમેદવારોએ એ “Confirm “ થયેલ અરજીપત્રક પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે અને જ્યારે પસંદગી પામેલ તથા પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવેલ ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો રજુ કરવાની જાણ કરવામાં આવે ત્યારે “Confirm “ થયેલ અરજીપત્રક રજુ કરવાનું રહેશે.
- (૧૬) દરેક જાહેરાત માટે ઉમેદવારે એક જ અરજી કરવી . આમ છતાં, સંજોગોવશાત, જો કોઈ ઉમેદવારે એક થી વધુ અરજી કરેલ હશે તો છેલ્લી “Confirm”થયેલ અરજી, તેની સાથે નિયત ફી ભરેલ હશે, તો તે માન્ય ગણાશે અને અગાઉની અરજી રદ ગણવામાં આવશે. અગાઉની અરજી સાથે ભરેલ ફી છેલ્લી “Confirm “ થયેલ અરજી સામે ગણવામાં આવશે નહીં. જો ઉમેદવારે છેલ્લી “confirm “ થયેલ અરજી સાથે નિયત ફી ભરેલ નહીં હોય તો આ ઉમેદવારની નિયત ફી સાથે ની “Confirm “ થયેલી છેલ્લી અરજી માન્ય ગણવામાં આવશે . જો ઉમેદવારે એક થી વધુ અરજી સાથે ફી ભરેલ હશે તો તે રિક્કડ કરવામાં આવશે નહિં.

### **અરજી ફી :**

- (૧) બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફીસમાં રૂ.૫૦૦/- અને અનામત વર્ગના ઉમેદવારોએ રૂ. ૨૫૦/-ભાવનગર મહાનગરપાલિકાની ફી+ પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે. અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે.
- (૨) અન્ય રાજ્યના અનામત ઉમેદવારોને ગુજરાત રાજ્યમાં અનામતનો લાભ મળવાપાત્ર થતો ન હોય તેઓએ ઉપર મુજબ ફી ભરવાની રહેશે.
- (૩) ફી ભર્યા વગરની અરજી રદ થવાને પાત્ર છે. ફી ભરેલ નહીં હોય તેવા ઉમેદવારને કોઈ પણ સંજોગોમાં **લેખિત પરીક્ષા / મૌખિક કસોટી**માં બેસવામાં આવશે નહીં. આ ફી ફક્ત પોસ્ટ ઓફીસ દ્વારા જ સ્વીકારવામાં આવશે. રોકડમાં, ડીમાન્ડ ડ્રાફ્ટથી, ઈન્ડિયન પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડરના સ્વરૂપમાં આ ફી સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

ઉમેદવારોને ખાસ જાણવવાનું કે, અરજીપત્રક તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમ્યાન કોઈ ઉમેદવાર, આ જગ્યા ના ભરતી નિયમો, તથા જાહેરાતની જોગવાઈઓ મુજબ લાયકાત ધરાવતા નથી તેમ માલુમ પડશે તો તેમની ઉમેદવારી કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે.

નોંધ; **સેનેટરી સબ ઈન્સ્પેક્ટર** જગ્યાની જાહેરાતની અન્ય વધુ વિગતો ભાવનગર મહાનગરપાલિકાની કચેરીના નોટીસબોર્ડ અને ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઈટ [www.bmcgujarat.com](http://www.bmcgujarat.com) તથા ઓજસ વેબસાઈટ ઉપર જોવા મળશે.